

સૌ ચાલો પાઠશાળા જઈએ

નિયમો

- આ યોજના મુંબઈ(ચર્ચગેટ થી વિરાર,સી.એસ.ટી/વી.ટી. થી કલ્યાણ,ભિંવડી અને પનવેલ),સુરત, બરોડા,અમદાવાદ અને જુનાગઢની સંઘ સંચાલિત પાઠશાળાઓ માટે છે.
- આ યોજનામાં તમામ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘો(તપાગચ્છ,અચલગચ્છ,ખરતરગચ્છ,પાઈચંદગચ્છ વિગેરે) જોડાઈ શકશે.
- આ યોજનામાં ૮ થી લઈને ૪૮ વર્ષ સુધીના બધા ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે.
- આ યોજના ૨ જુલાઈ ૨૦૧૯ થી ૨૯ ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી રહેશે. (અંદાજિત આઠ મહિના)
- આ ૮ મહિના દરમિયાન યોજનામાં ભાગ લેનાર ભાઈઓ-બહેનોએ ઓછામાં ઓછી ૬૮ નવી ગાથા અને ૧૨૫ દિવસ ની હાજરી સાથે પૂરી કરવાની રહેશે.
- આપની પાઠશાળાની હાજરી પાઠશાળામાં રહેલા શિક્ષક-શિક્ષિકાની સહી દરરોજ કરવાની રહેશે,જેની જવાબદારી યોજનામાં ભાગ લઈ રહેલા ભાઈઓ-બહેનો તથા સંઘના શિક્ષક/શિક્ષિકાઓની રહેશે.
- આ યોજનામાં ભાગ લઈ રહેલા ભાઈઓ-બહેનોએ દરેક મહિનાના અંતે, તે મહિનામાં કરેલી કુલ નવી ગાથા અને તે મહિનાની કુલ હાજરી લખીને,બુકમાં નીચેની બાજુએ આપે સંઘનો અથવા પાઠશાળાનો સ્ટેમ્પ અને પાઠશાળાના શિક્ષક/શિક્ષિકા પાસે ચેક કરાવી અને સહી કરાવવાની રહેશે.
- જે મહિનો પૂરો થઈ ગયો છે તે મહિનાની હાજરી અને કરેલી નવી ગાથાનું હાજરી પત્રક આપે તેના પછીના મહિનામાં ૧ થી ૧૦ તારીખ ની વચ્ચે આપેલ લીંક પર અપલોડ કરવાનું રહેશે. (જે લિંક આપને મળેલા કન્ફર્મેશન ઈમેલ ઉપર આપેલી છે)
- બેસ્ટ વિદ્યાર્થીનો એવોર્ડ તેણે નવી કરેલી ગાથાની સંખ્યા તથા તેની કુલ હાજરીની સંખ્યાથી ગણવામાં આવશે.

❖ નવી ગાથા કઈ રીતે ગણવી તે માટેની સમજણ

- નવા બધા સૂત્રો માટે 1 ગાથા = 1 ગાથા(અતિચાર સિવાય)
- અતિચાર માટે
 - 1 સ્થૂલ,વ્રત = 4 ગાથા (નવી ગાથા માટે)
 - 1 સ્થૂલ,વ્રત = 2 ગાથા (પુનરાવર્તન માટે)
- શકસ્તવ - ૪૦ ગાથા, પંચ સૂત્ર(1st સૂત્ર) - ૪૦ ગાથા, તત્વાર્થ સૂત્ર(સંપૂર્ણ) - ૧૫૦ ગાથા
- નવા સ્તુતિ સ્તવન સજ્જાય માટે 4 ગાથા = 1 ગાથા
- પુનરાવર્તન (પહેલા કરેલા સૂત્રો)
 - બે પ્રતિક્રમણ સુધીના સૂત્રો માટે 10 સૂત્રો = 1 ગાથા

- બે પ્રતિક્રમણથી ઉપરના સૂત્રો માટે અને વંદિતુ સુત્ર માટે **10 ગાથા = 1 ગાથા**
- જુના કરેલા સ્તુતિ સ્તવન અને સજ્જાય પુનરાવર્તન માં નવી ગાથા તરીકે ગણાશે નહીં

❖ પાઠશાળામાં હાજરી કઈ રીતે ગણાશે તે માટેની સમજણ

- એક હાજરી મેળવવા માટે પાઠશાળામાં ઓછામાં ઓછી 30 મિનિટની આપની હાજરી જરૂરી છે.
- બીજા જરૂરી કારણોસર અને સ્કૂલની પરીક્ષાના સમયે આપની ઓછામાં ઓછી 15 મિનિટની હાજરી ગણાશે.
- ચૌદશ અને પર્યુષણના દિવસોમાં સંઘમાં કરેલ પ્રતિક્રમણની તે દિવસની એક હાજરી મળશે (જેની સહી આપે આપના પાઠશાળાના શિક્ષક/શિક્ષિકા બહેનો પાસે તેના પછીના દિવસે લેવાની રહેશે)
- આપના સંઘમાં ચાલતી સંસ્કાર વાટિકા, શિક્ષણ સંઘ અને Learn & Turnમાં તમારી હાજરી એ તે દિવસની 1 હાજરી બરાબર ગણાશે
- જો આ યોજના દરમિયાન આપ ઉપધ્યાન કરવા અથવા માહરાજ સાહેબ પાસે રહેવા જાવ છો (એક સાથે ઓછામાં ઓછા પાંચ દિવસ) તો તેમાં 5 દિવસ = 3 હાજરી આપને મળશે. (રોકાયેલ દિવસોની તમને 50% હાજરી મળશે)
- અગર જો આપ આપના સ્વજનના ત્યાં છો કામથી બહારગામ છો અથવા આપ બીજે શિફ્ટ થઈ ગયા છો (મુંબઈ, અમદાવાદ, સુરત, બરોડા, જુનાગઢ આમાંથી કોઈ શહેરમાં) તો આપ ત્યાંની નજીકની પાઠશાળામાં જ્યાં આ યોજના ચાલુ છે ત્યાં જઈ ત્યાંના શિક્ષક/શિક્ષિકાની સહી અને પત્ર લઈ ત્યાં પાઠશાળા જઈ શકશો.
- આ સિવાયની બીજી કોઈ પણ રીતે હાજરી આ યોજનામાં ગણાશે નહિ.

❖ પાઠશાળાના શિક્ષક/શિક્ષિકાઓને મળવાનું ઇનામ કઈ રીતે ગણાશે તે બાબતની સમજણ

- ૨૫ પાઠશાળાના લકી ડ્રો માટે ઓછામાં ઓછા 20 વિદ્યાર્થીઓએ તે પાઠશાળામાંથી આ યોજનામાં ભાગ લીધેલો હોવો જોઈએ. (ઇનામમાં મળેલી રકમ પાઠશાળાના શિક્ષક/ શિક્ષિકા વચ્ચે વહેંચાશે)
- જો એક સંઘમાં કે એક એરીયામાં ચાલતી બાળક, બાલિકા, ભાઈઓ, બહેનોની જુદી જુદી બધી જ પાઠશાળાને તે સંઘની એક જ પાઠશાળા ગણવામાં આવશે.

- આમાંથી કોઈપણ નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર સમકિત ગ્રુપને છે.